

ત્વરિત જાહેરાત માટે

## મતદાનના દિવસે સમય બચાવવા મતદાતાઓની યાદી તપાસો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (સપ્ટેમ્બર 7, 2022) – સીટી ઓફ બ્રેમ્પટન પાત્રતા ધરાવતા બધાં મતદાતાઓને પોતે મતદાતાઓની યાદીમાં હોવાની ખાતરી કરવા કહી રહ્યું છે. 2022 નાં બ્રેમ્પટન મ્યુનિસિપલ અને સ્કૂલ બોર્ડ ઇલેક્શનમાં મત આપવાના હેતુસર પાત્ર મતદાતાઓ મતદાતાઓની યાદીમાં હોવા રહ્યાં.

આ પ્રક્રિયા સરળ છે. [સીટીની વેબસાઈટ](#) જુઓ, “Am I on the Voters’ List?” (શું હું મતદાતાઓની યાદીમાં છું) પર ક્લિક કરો અને તમારું નામ, જન્મ-તારીખ અને સરનામું જણાવીને તપાસી જુઓ કે તમે યાદીમાં છો કે કેમ. તમે તમારી માહિતી ઓનલાઈન ચકાસી શકો છો કે અદ્યતન કરી શકો છો, અથવા ઉમેરવા નોંધણી કરાવી શકો છો જો તમારું નામ યાદીમાં ના હોય. ઓનલાઈન નોંધણી ઓક્ટોબર 15 નાં રોજ સાંજે 5 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

પાત્ર મતદાતાઓ સીટી હોલમાં સીટી ક્લાર્કની ઓફિસે પણ જઈને તપાસી શકે છે કે શું તેઓ મતદાતાઓની યાદીમાં છે કે કેમ અને જરૂર પડે તો, વોટર્સ લિસ્ટ (મતદાતાઓની યાદી)નું ફોર્મ સુધારવા અરજી કરી શકે છે. મતદાતાઓ કોઈપણ એડવાન્સ વોટિંગ સ્થળે, અથવા મતદાનના દિવસે ફોર્મ પણ ભરી શકે છે.

તમે મત આપવાને પાત્ર છો જો તમે કેનેડિયન નાગરિક હો, મતદાનના દિવસે ઓછામાં ઓછાં 18 વર્ષની ઉંમરના હો, અને બ્રેમ્પટનમાં રહેતા હો (અથવા તમે કે તમારા પત્ની કે પતિ બ્રેમ્પટનમાં મિલકતના માલિક કે ભાડુઆત હો).

### કડીઓ (લિંક્સ)

- [શું તમે મતદાતાઓની યાદીમાં છો કે કેમ તે તપાસો](#)
- [મતદાતાની પાત્રતા](#)
- [બ્રેમ્પટનમાં મતદાન 2022](#)

### અવતરણ (ક્વોટ):

“તમે પાછલી ચૂંટણીઓમાં મત આપ્યો હોય અથવા સોમવાર, ઓક્ટોબર 24 નાં રોજ પહેલાં તમારી ઉંમર 18 વર્ષની હોય તો પણ, તમે મતદાતાઓની યાદીમાં હોવાનું તપાસવું મહત્વની બાબત છે. એક અદ્યતન મતદાતાઓની યાદી સમય બચાવે છે અને બધાં બ્રેમ્પટન મતદાતાઓ માટે મતદાન પ્રક્રિયાને સરળ બનાવે છે.”

- પીટર ફે (Peter Fay), સીટી ક્લાર્ક અને રિટર્નિંગ ઓફિસર (ચૂંટણી અધિકારી), સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ



## Media Release

કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ , અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca)

### મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)